

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૧/૦૩/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૪ વ્યક્તિઓને ઝડપી, ૮૫ લીટર દેશી દારૂ, ૦૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૯૦૮ બિયરટીન, ૦૧ સ્કુટર, ૦૧ મોટર સાયકલ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪,૨૦૭/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૩૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૬૨૩/૧૮

ચાંદખેડા : બીપીનભાઈ શિતારામ શર્મા (ઉ.વ.૩૮)(રહે,શુભ લક્ષ્મી સોસાયટી વિભાગ-૧ પ્રહલાદપાર્ક જગતપુર ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૩/૧૮ સાંજના કલાક ૬/૧૫ વાગ્યાના સુમારે ચાંદખેડા સંકલ્પગ્રીન સોસાયટીની બાજુમા આવેલ વળાંકનજીક એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) બીપીનભાઈના માતાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.કે.રાઠવા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૬૨૪/૧૮

રીવરફ્રન્ટ વેસ્ટ : દર્શીલભાઈ મનોજભાઈ શાહ (રહે, સુમેરૂ એપાર્ટમેન્ટ, પ્રિતમનગર અખાડા સામે, એલીસબ્રીજ) એ તા.૩૦/૩/૧૮ નારોજ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૩/૧૮ રાતના કલાક ૮/૦૦ થી ૮/૪૫ વાગ્યા દરમિયાન સાબરમતી રીવરફ્રન્ટ એન.આઇ.ડી.ની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાંથી અજાણી વ્યક્તિ દર્શીલભાઈનું એચ.પી.કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૪૯,૦૦૦/- મતાનું ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી જગદીશચંદ્ર આત્મારામ ચલાવે છે.

માધવપુરા : મુન્નીબેન W/o પ્રિતમસિંહ ભદોરીયા (ઉ.વ.૫૭)(રહે,કાંતીલાલની ચાલી ન્યુ સીવીલ હોસ્પિટલ ગેટ નં-૫ ની સામે, અસારવા) એ તા.૩૦/૩/૧૮ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૩/૧૮ ના કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે દુષ્ટેશ્વર મહાકાળી મંદિર ખાતે દર્શન કરવા સારૂ લેડીઝની લાઈન ઉભા હતા દરમ્યાન કોઈ અજાણી સ્ત્રી એ મુન્નીબેનની નજર યુકવી તેઓએ પહેરેલ સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૧,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એન.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૨૫/૧૮

સરખેજ : અબ્દુલકાદર રમજાનખાન પઠાણ (ઉ.વ.૫૯)(રહે,તાજપીરનો ટેકરો જયહીંદ હોટલની પાછળ સરખેજ) એ પોતાની બીમારીથી કંટાળી જઈ તા.૨૯/૦૩/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૩૦/૩/૧૮ સવારનાં ૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે પોતાના ઘરે રસોડામા પંખા સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ગોવિંદભાઈ કરશનભાઈ ચલાવે છે.

રખિયાલ : કુતિકાબેન ડો/ઓ અશોકભાઈ ગુડસે (ઉ.વ.૨૦)(રહે,નાગરદાસ પટેલની ચાલી લક્ષ્મી કોલોની પાસે રખિયાલ) એ કોઈ અગમ્ય કારણસર તા.૩૦/૦૩/૧૮ સાંજના ૬/૨૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.જે.ખરસાણ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.